

(A Kalpataru Group Enterprise)

August 06, 2022

Scrip Code: 522263	Trading Symbol: JMCPROJECT
Mumbai – 400 001	Mumbai – 400 051
Dalal Street,	Bandra-Kurla Complex, Bandra (East),
25 th Floor, Phiroze Jeejeebhoy Towers,	Exchange Plaza, Plot no. C/1, G Block,
BSE Limited	National Stock Exchange of India Ltd.
Corporate Service Department	The Listing Department

Sub.: Newspaper Advertisement for Notice of the meeting of the Equity Shareholders of JMC Projects (India) Limited convened pursuant to the directions of the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench

Dear Sir/Madam.

Pursuant to the provisions of Regulation 30 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and in accordance with the directions given by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench *vide* its Order dated 03rd August, 2022, we enclose herewith the copies of newspaper advertisements published today i.e. on Saturday, 06th August, 2022 in 'Financial Express' in English Language having nationwide circulation and 'Sandesh' in Gujarati Language, having circulation in the State of Gujarat, *inter alia*, informing the shareholders about the notice of the meeting of the Equity Shareholders of the Company to be held on Tuesday, 06th September, 2022 at 03:00 p.m. (IST) through Video Conferencing or Other Audio Visual Means, for the purpose of considering, and if thought fit, approving with or without modification(s), the proposed Scheme of Amalgamation of JMC Projects (India) Limited ("Company" or "Transferor Company") with Kalpataru Power Transmission Limited ("Transferee Company") and their respective shareholders, under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013.

The aforesaid Notice is also uploaded on the website of the Company: www.jmcprojects.com.

Kindly take the same on record.

Thanking You,

Yours sincerely,
For JMC Projects (India) Limited

Samir Raval

Company Secretary & Compliance Officer

Encl.: As above

Corporate Office: 6th Floor, Kalpataru Synergy, Opp. Grand Hyatt, Santacruz (E), Mumbai 400055.

T +91-22-6885 1500 • F +91-22-6885 1555 • E mumbai@jmcprojects.com

FINANCIAL EXPRESS

contract on behalf of Gazprom,

was moved to Gazprom Ger-

mania. In April, Gazprom gave

up its ownership in Gazprom

Germania.

Aditya Birla Fashion back in black in Q1

ADITYA BIRLA FASHION and Retail posted net profit of ₹94 crore for the quarter ended June against net loss of ₹352 crore last year on the back of

from operations rose 254% year-on-year to ₹2,875 crore on low base and improved consumer sentiment.

sales, leading to negative oper-

ating margin. This year, in April-June, the

However, the company said that inflationary pressure continued to expand cost base for retailers, most of which was passed on to end consumers.

company said that there has been a sharp recovery in Ebitda grew 33% over predemandacross categories and it Covid levels.

New Delhi, August 5 advancing some cargos from ing Singapore (GMTS). disruption might impact the Gazprom to buy 2.5 million tonnes of LNG. Supply from the US to make up for the Since volumes from GMTS fertiliser sector that uses gas as GAIL (INDIA) IS exploring varcontract is around 8-9% of shortfall in liquefied natural GMTS started since 2018. feedstock. GMTS, which had signed the ious ways, including entering gas (LNG) supply from total gas sales by GAIL on an GAIL had in 2012 signed a

Gazprom Marketing and Trad-

Gazprom default: GAIL looking for alternative ways to source LNG

annualised basis, any supply

KALPA-TARU

into term agreements and

KALPATARU POWER TRANSMISSION LIMITED

Regd. office: 101, Part-III, G.I.D.C. Estate, Sector - 28, GANDHINAGAR - 382 028, Gujarat, India Tel. +91 79 2321 4000; Fax: + 91 79 2321 1966 Email: cs@kalpatarupower.com; Website: www.kalpatarupower.com CIN: L40100GJ1981PLC004281

IN THE NATIONAL COMPANY LAW TRIBUNAL, AHMEDABAD BENCH CA (CAA) NO. 43/NCLT/AHM/2022

IN THE MATTER OF SECTIONS 230 TO 232 AND OTHER APPLICABLE PROVISIONS OF THE COMPANIES ACT, 2013

AND

IN THE MATTER OF SCHEME OF AMALGAMATION OF JMC PROJECTS (INDIA) LIMITED WITH KALPATARU POWER TRANSMISSION LIMITED AND THEIR RESPECTIVE SHARE-**HOLDERS**

Kalpataru Power Transmission Limited, a company incorporated under the Companies Act, 1956 having Corporate Identity Number: L40100GJ1981PLC004281 and its registered office at Plot No. 101, Part-III, GIDC Estate, Sector -28, Gandhinagar 382028, Gujarat, India.

SURYA SARATHI RAY

... Company/ Transferee Company

ADVERTISEMENT OF NOTICE CONVENING MEETING OF THE EQUITY SHAREHOLDERS OF THE COMPANY

Notice is hereby given that by an order dated 3rd August, 2022("Tribunal Order"), the Ahmedabad Bench of the National Company Law Tribunal ("Tribunal") has directed a meeting to be held of the Equity Shareholders of the Company, for the purpose of considering, and if thought fit, approving with or without modification(s), proposed Scheme of Amalgamation of JMC Projects (India) Limited ("Transferor Company") with Kalpataru Power Transmission Limited ("Company" or "Transferee Company") and their respective shareholders ("Scheme"), under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 ("Act").

In pursuance of the Tribunal Order and as directed therein, further notice is hereby given that meeting of the Equity Shareholders of the Company("Meeting") will be held on Tuesday, 6th September, 2022 at 12:15 P.M. (IST) via Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM"), in compliance with the applicable provisions of the Act read with the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, to transact the business as set out in the Notice.

In pursuance of the Tribunal Order and as directed therein, the Notice of the aforesaid Meeting along with the accompanying documents, have been sent through electronic mode to those Equity Shareholders whose e-mail IDs are registered with the Company Registered & Share Transfer Agent ("RTA") i.e. Link Intime India Private Limited or Depositories or the Company. Copy of the Scheme, statement under Sections 230 and 232 read with Section 102 and other applicable provisions of the Act read with Rule 6 of the Companies (Compromises. Arrangements and Amalgamations) Rules, 2016("CAA Rules") and accompanying documents can be accessed/downloaded from the website of the Company at www.kalpatarupower.com; the website of Central Depository Services (India) Limited ("CDSL") viz www.evotingindia.com, being the agency appointed by the Company to provide the e-voting and other facilities for convening of the Meeting and the website of the Stock Exchanges i.e., BSE Limited ("BSE") viz. www.bseindia.com and the National Stock Exchange of India Limited ("NSE") viz. www.nseindia.com. If so desired, person may obtain a physical copy of the Scheme, statement under Sections 230 and 232 read with Section 102 and other applicable provisions of the Act and Rule 6 of the CAA Rules, etc., free of charge from the registered office of the Company or written request in this regard, may be addressed to the Compliance Officer of the Company at cs@kalpatarupower.com or can be obtained from the office of its Advocates viz. Thakkar and Pahwa, Advocates, 71, New York Tower-A, Opp. Muktidham Derasar, Thaltej, Ahmedabad-380054.

The Tribunal has appointed Mr. Umesh Ved (Membership No. FCS 4411) of M/s. Umesh Ved & Associates, Practicing Company Secretaries, failing whom, Mr. Ravi Kapoor (Membership No. FCS 2587) of M/s. Ravi Kapoor & Associates, Practicing Company Secretaries as the Chairperson for the aforesaid Meeting.

Mr. Urmil Ved (Membership No. FCS 8094), Practicing Company Secretary and failing him, Mr. Umesh Parikh, (Membership No. FCS 4152) Partner of M/s. Parikh Dave & Associates, Practicing Company Secretaries, shall act as the Scrutinizer for the aforesaid Meeting. The abovementioned Scheme, if approved by the Equity Shareholders of the Company at the Meeting, will be subject to the subsequent sanction of the Tribunal and such other approvals, permissions and sanctions of regulatory or other authorities, as may be necessary.

The Equity Shareholders of the Company entitled to attend and vote at the aforesaid Meeting may vote through remote e-voting to cast their respective votes prior to the date of the Meeting or vote in person through e-voting at the meeting, by following the instructions provided in the Notice. Since the Meeting is being held through VC/ OAVM, physical attendance of Equity Shareholders has been dispensed with. Accordingly, the facility for appointment of proxies by the Equity Shareholders will not be available for the Meeting. A member may participate in the Meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the Meeting.

The cut-off date for e-voting and time period for the remote e-voting of the aforesaid Meeting

as under.	
Equity Shareholders meeting	
Cut-off date for e-voting	Tuesday, 30 th August, 2022
Remote e-voting start date and time	Friday, 2 nd September, 2022 at 9:00 A.M. (IST)
Remote e-voting end date and time	Monday, 5 th September, 2022 at 5:00 P.M. (IST)

The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and remote e-voting module shall be forthwith disabled by CDSL upon expiry of the aforesaid period.

An Equity Shareholder, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, i.e. Tuesday, 30th August, 2022 only shall be entitled to exercise his/her/its voting rights on the resolution proposed in the Notice and attend the Meeting. Voting rights of an Equity Shareholder/ Beneficial Owner (in case of electronic shareholding) shall be in proportion to his/her/its shareholding in the paid-up equity share capital of the Company as on the cut-off date. Those persons who have acquired shares and have become Equity Shareholders of the Company after the dispatch of Notice of the Meeting by the Company and whose names appear in the Register of Members or Register of beneficial holders as on the cut-off date shall view the Notice of the Meeting on the Company's website or on the website of CDSL. Such persons may obtain/generate the login ID and password by following process stated in the Notice of the Meeting.

Equity Shareholders holding shares in physical mode, who have not registered/ updated their email addresses with the Company, are requested to register/ update the same by writing an application to the Company with details of Folio Number and attaching a self-attested copy of PAN card to Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent of Company at ahmedabad@linkintime.co.in or to the Company at cs@kalpatarupower.com.

Equity shareholders holding shares in dematerialised mode, who have not registered their e-mail addresses with their Depository Participant(s), are requested to register/ update their email addresses with the Depository Participant(s) with whom they maintain their demat

Equity shareholders seeking any information with regard to the Scheme or the matter proposed to be considered at the aforesaid Meeting, are requested to write an application to the Company on or before Friday, 26th August, 2022 through email on cs@kalpatarupower.com. In case of queries relating to e-voting, Equity Shareholders are requested to note the following

Mr. Rakesh Dalvi, Sr. Manager Central Depository Services (India) Limited Marathon Futurex, A-Wing, 25th floor, NM Joshi Marg, Lower Parel, Mumbai 400013 Email Id: helpdesk.evoting@cdslindia.com

Contact Nos.: 022 - 23058738 and 022- 23058542-43 In case of any other queries, Equity Shareholders are requested to note the following contact

Link Intime India Private Limited 506-508, Amarnath Business Centre -1

contact details:

Beside Gala Business Centre, Near St. Xavier's College Corner, Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380009, Gujarat, India

Email: ahmedabad@linkintime.co.in Tel. & Fax: 91 79 26465179 Dated: 5th day, August 2022.

Mr. Umesh Ved Chairperson appointed for the meeting of Equity Shareholders of the Company

JMC Projects (India) Limited

(A Kalpataru Group Enterprise) Regd. Office: A-104, Shapath 4, Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad - 380015 Tel: 079 68161500, Fax: 079 68161560,

20-year contract with Russia's

E-mail: cs@jmcprojects.com, Website: www.jmcprojects.com **CIN**: L45200GJ1986PLC008717

IN THE NATIONAL COMPANY LAW TRIBUNAL, AHMEDABAD BENCH CA (CAA) NO. 43/NCLT/AHM/2022

IN THE MATTER OF SECTIONS 230 TO 232 AND OTHER APPLICABLE PROVISIONS OF THE COMPANIES ACT, 2013 **AND**

IN THE MATTER OF SCHEME OF AMALGAMATION OFJMC PROJECTS (INDIA) LIMITED WITH KALPATARU POWER TRANSMISSION LIMITED AND THEIR RESPECTIVE SHARE-**HOLDERS**

JMC Projects (India) Limited, a company incorporated under the Companies Act, 1956 Corporate Identity Number: L45200GJ1986PLC008717 and its registered office at A-104, Shapath 4, Opp.Karnavati Club, S. G. Road, Ahmedabad -380015, Gujarat, India.

...Company/ Transferor Company

ADVERTISEMENT OF NOTICE CONVENING MEETING OF THE EQUITY SHAREHOLDERS OF THE COMPANY

Notice is hereby given that by an order dated 03rd August, 2022("Tribunal Order"), the Ahmedabad Bench of the National Company Law Tribunal ("Tribunal") has directed a meeting to be held of the Equity Shareholders of the Company, for the purpose of considering, and if thought fit, approving with or without modification(s), proposed Scheme of Amalgamation of JMC Projects (India) Limited ("Company" or "Transferor Company") with Kalpataru Power Transmission Limited ("Transferee Company") and their respective shareholders ("Scheme"), under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 ("Act") In pursuance of the Tribunal Order and as directed therein, further notice is hereby given that meeting of the Equity Shareholders of the Company ("Meeting") will be held on Tuesday, 06th September, 2022 at 03:00 p.m. (IST) via Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM"), in compliance with the applicable provisions of the Act read with the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, to transact the business as set out in the Notice.

In pursuance of the Tribunal Order and as directed therein, the Notice of the aforesaid Meeting along with the accompanying documents, have been sent (i) through electronic mode to those Equity Shareholders whose e-mail IDs are registered with the Company Registrar & Share Transfer Agent ("RTA") i.e. Link Intime India Private Limited or Depositories or the Company.

Copy of the Scheme, statement under Sections 230 and 232 read with Section 102 and other applicable provisions of the Act read with Rule 6 of the Companies (Compromises, Arrangements and Amalgamations) Rules, 2016("CAA Rules") and accompanying documents can be accessed/downloaded from the website of the Company at www.jmcprojects.com; the website of Central Depository Services (India) Limited ("CDSL") viz. www.evotingindia.com, being the agency appointed by the Company to provide the e-voting and other facilities for convening of the Meeting and the website of the Stock Exchanges i.e., BSE Limited ("BSE") viz. www.bseindia.com and the National Stock Exchange of India Limited ("NSE") viz. www.nseindia.com. If so desired, person may obtain a physical copy of the Scheme, statement under Sections 230 and 232 read with Section 102 and other applicable provisions of the Act and Rule 6 of the CAA Rules, etc., free of charge from the registered office of the Company or a written request in this regard, may be addressed to the Company Secretary of the Company at cs@imcprojects.com. or can be obtained from the office of its Advocates viz. Thakkar and Pahwa, Advocates, 71, New York Tower-A, Opp. Muktidham Derasar, Thaltej, Ahmedabad-

The Tribunal has appointed Mr. Umesh Ved (Membership No. FCS 4411) of M/s. Umesh Ved & Associates, Practicing Company Secretaries, failing whom, Mr. Ravi Kapoor (Membership No. FCS 2587) of M/s. Ravi Kapoor & Associates, Practicing Company Secretaries as the Chairperson for the aforesaid Meeting.

Mr. Urmil Ved (Membership No. FCS 8094), Practicing Company Secretary and failing him, Mr. Umesh Parikh, (Membership No. FCS 4152) Partner of M/s. Parikh Dave & Associates, Practicing Company Secretaries, shall act as the Scrutinizer for the aforesaid Meeting. The above mentioned Scheme, if approved by the Equity Shareholders of the Company at the Meeting, will be subject to the subsequent sanction of the Tribunal and such other approvals, permissions and sanctions of regulatory or other authorities, as may be necessary.

The Equity Shareholders of the Company entitled to attend and vote at the aforesaid Meeting may vote through remote e-voting to cast their respective votes prior to the date of the Meeting or vote in person through e-voting at the meeting, by following the instructions provided in the Notice. Since the Meeting is being held through VC/ OAVM, physical attendance of Equity Shareholders has been dispensed with. Accordingly, the facility for appointment of proxies by the Equity Shareholders will not be available for the Meeting. A member may participate in the Meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the Meeting.

The cut-off date for e-voting and time period for the remote e-voting of the aforesaid Meeting

is as under.	
Equity Shareholders meeting	
Cut-off date for e-voting	Tuesday, 30 th August, 2022
Remote e-voting start date and time	Friday, 2 nd September, 2022 at 9:00 a.m. (IST)
Remote e-voting end date and time	Monday, 5 th September, 2022 at 5.00 p.m. (IST)

The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and remote e-voting module shall be forthwith disabled by CDSL upon expiry of the aforesaid period.

An Equity Shareholder, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, i.e. Tuesday,30th August, 2022 only shall be entitled to exercise his/her/its voting rights on the resolution proposed in the Notice and attend the Meeting through VC/OAVM. Voting rights of an Equity Shareholder/ Beneficial Owner (in case of electronic shareholding) shall be in proportion to his/her/its shareholding in the paid-up equity share capital of the Company as on the cut-off date. Those persons who have acquired shares and have become Equity Shareholders of the Company after the dispatch of Notice of the Meeting by the Company and whose names appear in the Register of Members or Register of beneficial holders as on the cut-off date shall view the Notice of the Meeting on the Company's website or on the website of CDSL. Such persons may obtain/generate the login ID and password by following process stated in the Notice of the Meeting.

Equity Shareholders holding shares in physical mode, who have not registered/updated their email addresses with the Company, are requested to register/ update the same by writing an application to the Company with details of Folio Number and attaching a self-attested copy of PAN card to Link Intime India Private Limited, Registrar and Share Transfer Agents of the Company at ahmedabad@linkintime.co.in or to the Company at cs@jmcprojects.com.

Equity shareholders holding shares in dematerialised mode, who have not registered their email addresses with their Depository Participant(s), are requested to register/ update their email addresses with the Depository Participant(s) with whom they maintain their demat accounts.

Equity shareholders seeking any information with regard to the Scheme or the matter proposed to be considered at the aforesaid Meeting, are requested to write an application to the Company on or before Friday, 26th August, 2022 through email on cs@jmcprojects.com.

In case of gueries relating to e-voting, Equity Shareholders are requested to note the following contact details:

Mr. Rakesh Dalvi, Sr. Manager Central Depository Services (India) Limited

Marathon Futurex, A-Wing, 25th floor,

NM Joshi Marg, Lower Parel, Mumbai 400013 Email Id: helpdesk.evoting@cdslindia.com

Contact Nos.: 1800 22 55 33, 022 - 23058738 and 022- 23058542-43

In case of any other queries, Equity Shareholders are requested to note the following contact

Link Intime India Private Limited

506-508. Amarnath Business Centre -1 Beside Gala Business Centre,

Near St. Xavier's College Corner,

Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380009,

Gujarat, India

Sd/-

Email: ahmedabad@linkintime.co.in Tel. & Fax: 91 79 26465179

Dated: 5th day, August 2022.

Mr. Umesh Ved

Chairperson appointed for the meeting of Equity Shareholders of the Company

financialexp.epap.in

FE BUREAU REPORT CARD Mumbai, August 5 (₹ cr) Q1FY22 Q1FY23 🙎 % change (y-o-y)

Revenue

profit

operations 2,875

Ebitda margins (%)

Q1FY22

17.80

festive season.

brand building.

-352

expects the momentum to con-

tinue in upcoming quarters,

with a further boost during the

confidence, brands and retailers are now back to aggressive store

network expansion, the com-

pany said in its investor presen-

tation. The company also said it

would enhance investments in

pany's lifestyle brands' rev-

enues grew 51% over pre-

Covid levels to ₹1,519 crore,

while earnings before interest

tax, depreciation and amorti-

zation grew 40% to ₹266 crore.

reported highest ever rev-

enues of ₹1,027 crore, while

Pantaloons business

For April-June, the com-

With improved consumer

Q1FY23

a 17.40

improved sales after Covid. The company's revenue

Last year, second Covid wave had led to demand destruction. as a result of which, the company's sales suffered and total expenses were higher than the

company reported operating margin of 17.4%, up 130 basis points over pre-Covid levels. Margin could have expanded more had it not been for 112% year-on-year increase in total expenses due to high raw

material cost.

On overall performance, the

Raymond reports Q1 net profit at ₹82 crore

FE BURAU Ahmedabad, August 5

IN VIEW OF high inventory and overall increase in expenses, India's largest integrated worsted suiting manufacturer Raymond posted ₹81.93 crore consolidated net profit for the quarter ended on June 30, down 52.15 % from ₹157.10 crore it had reported in the same period last year.

The company's expenses on manufacturing and operating (stores & spares consumed, power & fuel, job work charges etc.) increased to ₹230.09 crore in the quarter as against ₹143.50 crore last year during the corresponding period.

The company's net revenue increased by 104% on a yearon-year basis from ₹862 crore to ₹1,754 crore. Ebitda remained at ₹235 crore for the quarter as compared to ₹7 crore in Q122. Percentagewise Ebitda increased by 1,260 bps

from 0.8 % to 13.8%. According to the company, Q1 witnessed temporarily high inventory on account of higher production to address the upcoming festival and wedding season sales. This led to increase in working capital, resulting in

an increase in net debt by ₹222



crore to ₹1,310 crore.

Commenting on the company's performance for April-June, Gautam Singhania, chairman & managing director, Raymond, said that the company continued focus on operating and financial parameters across businesses, supported by expansive network, quality products and services led to highest first quarterly

revenue and profitability. "The growing demand in both domestic and international markets along with new customer acquisitions in international markets has been rewarding for the quarter. Furthermore, our real estate project is progressing well with sales velocity and construction pace of both the projects at Thane. This helps us to deliver strong performance for our

Real estate business," said

Singhania.

Mercedes-Benz to make fully-electric luxury sedan EQS 580 in Pune

FE BUREAU

Ahmedabad, August 5 **BUOYED BY THE** Centre's

push for promotion of electric vehicles (EVs), Mercedes-Benz is planning to manufacture fully-electric luxury sedan EQS 580 at its Pune facility in October this year.

"We are emphasising on EVs in the Indian market. At present, Mercedes-Benz is selling only one EV model EQC luxury sedan, which is fully imported. From August to December this year, five more new models will be launched in the Indian market. However, we will make only EQS 580 at the Pune facility," confirmed Martin Schwenk, managing director and CEO Mercedes-Benz India on the sidelines of the inauguration of the company's first 'Integrated AMG Performance

Centre'in Ahmedabad. Schwenk said that the central government and many other state governments are giving incentives on EVs which would help increase sales of EVs across the country. "Currently our EV sales are negligible, but we are aiming at achieving 25% of total sales of



Mercedes-Benz cars by the end of year 2027, "he said.

During the first half of 2022, Mercedes-Benz India delivered 7,573 units as against 4,857 units between January and June last year, indicating 56% jump in sales. It also witnessed the highest secondquarter deliveries of 3,551 cars to date with 113.5% sales growth, as against the Q2 in the previous year. The company achieved the highest ever annual delivery of 15500 units in the year 2018 in India.

In wake of increasing demand for luxury cars post Covid-19 pandemic, Schwenk expects to cross 2018 figures during the current calendar year.The German automaker is witnessing strong demand for the S-Class Maybach, GLS, and high-performance AMG models.

આથી સદરહુ જમીન ઉપર કોઈનો

કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો, અલાખો, બોજો કે ગણોતીયા હકક હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭માં અમોને તે બદલ ના દસ્તાવેજી પુરાવા સહીત નીચેના સરનામે ૨જી. એ.ડી.થી જાણ કરવી. જો તેમ કરવામાં નહી આવે તો સદરહ જમીન ઉપર અન્ય કોઈ વ્યકિતનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો, અલાખો, બોજો કે ગણોતીયા હકક નથી અને જો હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની લાગતા વળગતાએ નોંધ લેવી. સ્થળઃ- અમદાવાદ. તારીખ : ૦૫/૦૮/૨૦૨૨. હરસિધ્ધી એસોસીએટસ જયદિપસિંહ એ. સોઢા પરમાર (એડવોકેટ એન્ડ નોટરી) ઓફીસ- જી-૧૨, ૧૮, ગ્રાઉન્ડ ફ્લોર, ઓમ આર્કેડ, એમ.બી. પટેલ હોસ્પીટલ પાસે, મારૂતી સુઝુકી શો-રૂમ સામે, એસ.પી. રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ-૩૮૨૪૧૮. મો. નં. ૯૮૨૫૬ ૩૨૯૦૪, મો. નં. ૮૭૩૫૯ ૮૫૨૪૧.

જાહેર નોટિસ

(મોજે : ઓળા)

આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકા કલોલના મોજેઃ ઓળા ગામની સીમના ખાતા નં . ૨૭૩માં સમાવિષ્ટ રી-સર્વે મુજબના નવીન બ્લોક નંબર રર૭ (જુના બ્લોક નંબર-૩૩૨)ની કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૧૮-૬૬ આકાર રૂા. ૧.૮૦વાળી જુની શરતની ખેતીલાયક ઉપયોગવાળી જમીન (૧) ઠાકોર ચંચીબેન રવાજી (૨) ઠાકોર જીવણજી રવાજી (૩) ઠાકોર ભુપતજી રવાજી (૪) ઠાકોર કંકુબેન તે ધુળાજીની વિધવા (૫) ઠાકોર જશીબેન ધુળાજી (૬) ઠાકોર રામીબેન ધુળાજી (૭) ઠાકોર માનસંગજી ધુળાજી (૮) ઠાકોર કમલેશજી ધુળાજી (૯) રેશમબેન અમરતજી ઠાકોર (૧૦) મહેશજી અમરતજી ઠાકોર (૧૧) ગોપાલજી અમરતજી ઠાકોર તમામ રહે. ઓળા, તા. કલોલનાની સંયુકત માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી મુક્ત કોઈના કોઈપણ વારસાઈના, સહભાગીદારીના કે અન્ય કોઈપણ પ્રકારના હક્ક, હિત, હિસ્સા વિનાની આવેલ હોવાનું જણાવી સદરહુ જમીન અંગેના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની

અમારી પાસે માંગણી કરેલી છે.

તો સદરહુ જમીન ઉપર અન્ય જે

કો ઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીત, હિસ્સો, દાવો કે બોજો વિગેરે કોઈપણ પ્રકારનો હક્ક પોષાતો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને તે બદલના પુરાવા સહીત લેખીત જાણ નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર કે તેના કોઈપણ ભાગ ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર, લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો, લીયન કે અન્ય કોઈ રીતે કોઈ હિત સંબંધથી પ્રાપ્ત થતા હક્કો નથી અને હોય તો તે જતા (Waive) કરેલા છે. તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહી. જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. સ્થળ : કલોલ તારીખ : ૦૫/૦૮/૨૦૨૨ સુષ્ટી એસોસીયેટ્સ ભરત કે. નાયક (એડવોકેટ) રાજેશ પી. પટેલ (એડવોકેટ) ઑફિસ : પ્લોટ નં. ૧૪૪, વર્ધમાનનગર, સરદાર બગીચા પાણીની ટાંકી સામે, કલોલ, તા.કલોલ, (ઉ.ગુ.),જી. ગાંધીનગર. પિન કોડ નં. ૩૮૨૭૨૧ મો. નં. ૯૪૨૬૫૯૧૫૨૬ ८२००३६०२२१

એડવર્ટાઇઝમેન્ટ

તા. ૦૧.૦૬.૨૦૧૬થી અમલમાં

સંદેશ જાહેર નોટિસ

(રાઇટલ ક્લિયરન્સ) 31.990/-

અહિંદ મભદ મુખેજર ફોન : ૦૯૯-૪૦૦૦૪૧૧૩

प्रति सार्धन हीह

SANDESH AHMEDABAD SATURDAY, 6-08-2022

જાહેર નોટિસ

કે. રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ ડિસ્ટ્રીકટ સાણંદના તાલુકા -રહીત હોવાનું જણાવીને અમારા તેની ગંભીર નોંધ લેવી. અસીલને વેચાણ આપવાનું નક્કી કરી K & K ASSOCIATES અમારી પાસેથી સદરહું મીલ્કતનું **કુણાલ એમ. પટેલ** ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની **કુશાન એન. પટેલ**

કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, શીલજ સર્કલ, શીલજ,અમદાવાદ. હિત, હિસ્સો, દાવો, બોજો હોય તો મો. નં. : ૯૭૩૭૧ ૫૫૫૨૦

આથી જાહેર જનતાને જણાવવાનું સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં સાણંદના ગામ મોજે માણકોલની આવે તો સદરહુ મીલ્કત ઉપર અન્ય સીમના ખાતા નં. ૯૨૫ના બ્લોક/સર્વે કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો નં. ૭૦૭ની હે.આરે.ચો.મી. ૬- લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, રદ-૨૫યાને કેદરદ૨૫ ચો. મી.ના દાવો, બોજો નથી અને હોય તો તે જતો ક્ષેત્રફળની આકાર રૂા. ૧૯.૮૧ વિવ) કરેલ છે તેમ માની અમો પૈસાવાળી ખેતીની જમીન માઇલક ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ વેરની સ્વતંત્ર માલીકી અને કબજા આપીશું અને ત્યારબાદ કોઇની ભોગવટાની તથા તમામ બોજાઓ કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં

તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-

તેજસ જે. પટેલ (એડવોકેટસ)

Public Notice

To Whomsoever it may

concern The Non-Agricultural land for the industrial purposes which is located in District, Sub-District Ahmedabad, Taluka of Sanand, Village: Vasna Eyava Survey No. 183/A Paiki of 11 to 16, Sub plot No.11, 12, 13, 14, 15, 16 area of 8004 sq.mtrs. The Director of the Hi-Tech Amusement Pvt, Prakashchandra B. Goenka, residing at: 7/24, Taxshila ecogreen, Vastral. Ahmedabad, has requested for the title clearance certificate from us. The aforesaid land is not acquring defective title claimed by Mr. Prakashchandra

If there is any kind of part, right, violence, interest, relationship, objection, dispute, etc. due to the land of someone else, that person should notify us in the period of days-7 (Seven) to our address from the registration id. Otherwise, any protion, right, violence, interest, relation, objection, conflict, etc. of any person in possession of the said land is there or not will not be entertained or waived off and the certificate of title shall be issued, After that the conflict of any person will not be considered,

Date: 05/08/2022 H. Vyas & Co., Harendra B. Vyas, Advocate, Samir (Gopal) Dave, Advocate Offi: A/401-402, "Harivilla" Near Sarthi Hotel Gurudwara Road, Vastrapur, Bodakdev, Ahmedabad-54.

જાહેર નોટિસ

આથી જાહેર જનતા અને લાગતા વળગતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટીકટ અમદાવાદના સબ-ડીસ્ટીકટ માંડલના મોજે ગામ- ઉકરડીની સીમમાં આવેલ ખેડખાતા નંબર-૬૮૫ના નવા બ્લોક/સર્વે નંબર-૩૩૯ (જુનાબ્લોક/ સર્વે નંબર-૩૭/૨/૨ પૈકી)ની કુલ હે.આરે.ચો.મી.૧૦-૪૩-૫૬ પૈકી ૦-૭૧-૩૪ જેનો આકાર-૨૪.૪૫ પૈકી વરાડે પૈસાવાળી ખેતીની જમીન અમારા અસીલ નામે અનુભા સામંતસંગ સોલંકીની સ્વતંત્ર કબજા ભોગવટાની જાતે ખેડહકકની બોજા રહિત માલીકીની ચાલતી આવેલ છે. ઉપરોક્ત બ્લોક/સર્વે નંબરવાળી ખેતીની જમીન બોજા રહિત તેમજ માર્કેટેબલ જણાવી તેઓએ અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ યાને હકક હિસ્સો, અલાખો, સંબંધ, ગીરો, બાનાખત,કબજા કરાર, સમજુતી કરાર કુલ મુખત્યારનામું, લીસપેન્ડન્સ, બોજો, લીયન, ઈઝમેન્ટ રાઈટસ,ગણોત હકક, વારસા હકક અથવા સંસ્થા, બેંક કે મંડળીનો બોજો હોય તથા કોઈનો કોઈપણ પ્રકારનો સદરહુ જમીન ઉપર લેણું હોય તો અમોને નીચેના સરનામે દિન-૭માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી.થી જાણ કરવી. અને તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હકક રહેલો નથી અને હોય તો જતો(વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપવામાં આવશે અને તે પછી કોઈનો કોઈપણ જાતનો વાંધો કે તકરાર ચાલશે નહી.જેની નોંધ લેશો. સ્થળ- માંડલ

તા. ૦૫/૦૮/૨૦૨૨

વકીલ મારફતે

અમારા અસીલની સુચના અન્વયે

KAMLESH K. CHAVDA

એ.પી.એમ.સી દુકાન નંબર-૭,

મુ.તા. માંડલ, જીલ્લો-અમદાવાદ.

M.A. LLB. Advocate

માંડલ-દશાડા હાઈવે,

MO. 94281 11746

તો સદરહુ જમીન ઉપર કોઇનો ઓફીસ : ૫૦૧, શીલ્પ ધ એડ્રેસ,

જાહેર નોટિસ આથી અમારા અસીલ (૧)

પટેલ શોભનાબેન તે પ્રભુભાઈના દીકરી તે મુકુંદભાઈ પટેલના પત્ની તથા (૨) દિવ્યેશ દશરથભાઈ પટેલ રહે. શોલા, અમદાવાદની સૂચનાથી જાહેર જનતાને જણાવવાનું મોજે-વિસતપુરા, તા. કડીના ગામની સીમની જુની શરતની જમીન સર્વે નંબર-૪૨૭ (જુના સ.નં. ૨૩૨) હે.આરે.ચો.મી. ૧-૧૮-૩૧ ક્ષેત્રફળવાળી જમીન પટેલ પ્રેમજીભાઈ મગનદાસ પાસેથી અમારા અસીલશ્રીનાએ વેચાણ દસ્તાવેજ નો. નં. ૧૧૧૩૩તા. ૦૨-૦૭-૨૦૨૨ના રોજથી ઈ ધરા કેન્દ્ર કડીમાં પડેલ વેચાણ નોંધ નંબર-૨૦૦૩થી વેચાણ રાખેલી છે. એમ સદરહુ જમીન અમારા અસીલશ્રીની વેચાણ હકકની માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી મુકત તથા કાનુની વિવાદોથી મુકત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફ્રીકેટની માંગણી કરેલ સદરહુ જમીન ઉપર કોઈનો બોજો, ચાર્જ, ગણોત હકક ખેડહકક કે અન્ય કોઈપણ પ્રકારનો લાગભાગ યાને હકક હીસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૧૦માં લેખીત પુરાવા સહીત ૨જી. એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ જાતનો લાગભાગ યાને હકક હીસ્સો રહેલો નથી તેમ સમજી મુદત વિત્યે સદર જમીનનું ટાઈટલ કલીયર સર્ટીફ્રીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછી કોઈનો કોઈપણ જાતનો વાંધો તકરાર

ચાલશે નહી. તા. ૦૫-૦૮-૨૦૨૨ સરોદે લીગલ એસોસીએટ્સ (દાદા વકીલની ઑફિસ) મેહુલ એચ. કોળેકર (દાદા) મહેન્દ્રભાઈ એસ. નાયક (એડવોકેટ-કડી), કલ્પેશ કે. प्रश्नपति (८३२०६३११४७) (૯૭૨૬૩૭૬૪૭૬) ઑફિસ : જી-૧૯, જી-૧૬, રાજવી પ્લાઝા કરણનગર રોડ, નવીન મામલતદાર કચેરી રોડ, મુ. કડી, તા. કડી.

જાહેર નોટિસ

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણાના સબ ડીસ્ટ્રીકટ કડી તથા તાલુકો કડીના મોજે ગામ - વરખડીયાની સીમના ખાતા નં. ૬૭૨ ના રીસર્વે મુજબ બ્લોક નં. પદ્દ૭ (જુનો સર્વે નં. ૩૨૫/ ૧ પૈકી ૬)ની કુલ ૭૦૫૬ ચોરસમીટરવાળી જમીનના માલીક રબારી વિનોદકુમાર સાગરભાઇએ ૨જી. વેચાણ દસ્તાવેજ નં. ૧૨૨૬૪/ ૨૦૨૨ તા. ૧૮/૦૭/૨૦૨૨ના રોજ ઠાકોર મફીબેન રવાજી પાસેથી ખરીદેલ છે અને તે અંગે વેચાણ નોંધ નં. ૩૧૫૩ થી પડેલ છે અને સદર જમીન તેઓની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની જમીન હોવાનું જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને સદરહુ જમીનના ટાઇટલ કલીયર સર્ટીફિકેટ/અભિપ્રાયની અમારી પાસેથી માંગણી કરેલ છે.

તો સબબ ઉપરોક્ત જમીન પરત્વે હર કોઇ શખ્સનો, હર કોઇ પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલો હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઇડ નકલ સહિત દિન - ૭ (સાત)માં નીચેના સરનામે રજી. એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હરકોઇ શખ્સના કોઇ હક્કો આવેલા નથી અગર આવેલ હોય તો જમીનના માલીકોની તરફેણમાં જતા કરેલ છે તેમ સમજી ઉપરોક્ત જમીનનું ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટ/અભિપ્રાય કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહિ જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી. (નોંધ: પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહિ.)

સ્થળ : અમદાવાદ તા. 03/0८/૨૦૨૨ મહેશ આર. ઠાકોર (એડવોકેટ) રાહુલ એસ. ઠાકોર (એડવોકેટ) જયેશ આર. ઠાકોર (એડવોકેટ) કિસ્મત જે. ઠાકોર (એડવોકેટ) ઓફીસ : ૫૦૮, શીલ્પ ધ એડ્રેસ, એસ.પી. રીગ રોડ, શીલજ સર્કલ, શીલજ, અમદાવાદ - ૩૮૦૦૫૯. મો. ૯૯૭૯૧૯૯૨૧૪

ટૂંકી મુદતની ઓનલાઈન જાહેર નિવિદા-૬૯ (૨૦૨૨-૨૩) 罗 પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનીટ, ગાંધીનગર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)

અધિકાક ઈજનેરશ્રી, પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનીટ, ૪થો માળ, પી.આઈ.યુ./આ૨.ડી.ડી./એન.એચ.એમ. બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ गांधीनगर-उ८२०१२ होन नं. (०७६) २३२३९४३४ अने ईड्स नं. (०७६) ૨૩૨૩૧૯૯૫ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઈજારદારો પાસેથી ૩ (ત્રણ) કામ જે કામની અંદાજીત કિંમત રૂ. ૯૯.૯૯ થી રૂ. ૨૨૪૬.૭૩ લાખની છે. જે કામ ઓનલાઈન ઈ-ટેન્ડરીંગ પદ્ધતિથી ટેન્ડર માંગવામાં આવે છે. આ કામ ટેન્ડરના દસ્તાવેજો વેબસાઈટ www.nprocure.com ઉપર તા. ૨૦-૦૮-૨૦૨૨ ના ૧૮.૦૦ કલાક સુધી જોવા મળી શકશે. વધારાની વિગતો માટે ઉપર જણાવેલ વેબસાઈટ જોવા વિનંતી છે. નોંધ:-૧ ટેન્ડર ફી, ઈ.એમ.ડી. વિગેરે ઓરીજનલ ડોક્યુમેન્ટ, ઓનલાઈન સ્કેન કરી અપલોડ કરી ટેન્ડર સબમીશન છેલ્લી તારીખથી ૭ (સાત) દિવસમાં આર.પી.એ.ડી.થી માહિતી/૧૦૬૬/૨૨-૨૩

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (ગુજરાત સરકારનું સંપૂર્ણ માલિકીનું સાહસ)

અધિક્ષક ઇજનેરશ્રી (ઓ એન્ડ એમ), સ.સ.ન.નિ.લી., ગાંધીનગર હસ્તકનું કામ

ટેન્ડર નોટિસ નં. ૦૬ સને ૨૦૨૨-૨૩

તા. ૨૫/૦૮/૨૦૨૨, ૧૮.૦૦ કલાક સુધી.

(૧) કામનું નામ : પ્રોવાઇડીંગ સર્વિસીસ ફોર મેન્યુઅલી એઝ વેલ એઝ ઇલેક્ટ્રીક્લી ઓપરેશન ઓફ વેરીયસ ગેટસ ખોફ રેગ્યુલેટીંગ સ્ટ્રક્ચર્સ એચ.આર. / સી.આર. / એસ્કેપ, ઇટીસી ઓફ નર્મદા મેઇન કેનાલ રી ચેઇનેજ ૧૪૪.૫૦૦ ટુ ૨૯૩.૫૦૧ કી.મી. ફોર વન ચર. (૨) અંદાજીત ૨કમ : રૂા. ૧૯૭.૦૯ લાખ

નોંધ: ટેન્ડર ભરતાં પહેલા કામગીરીના કાર્યક્ષેત્રની નર્મદા મુખ્ય નહેરની સ્થળસ્થિતિની મુલાકાત લદ તથા કરવાની થતી કામગીરીની જાણકારી મેળવીને જ ટેન્ડર ભરવા વિનંતી છે.

વધુ માહિતી માટે વેબસાઇટ : www.ssnnl.nprocure.com જુઓ માહિતી/૧૦૭૩/૨૨-૨૩

KALPA-TARU

POWER TRANSMISSION LIMITED

કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ

રિજ. ઓફિસ: ૧૦૧, ભાગ-III, જી.આઈ.ડી.સી. એસ્ટેટ, સેક્ટર-૨૮, ગાંધીનગર-૩૬૨૦૨૮, ગૂજરાત, ભારત. टेलि. : +६१ ७६ २३२१ ४०००, ईन्स : +६१ ७६ २३२१ १६६६. ઈ-મેલ : cs@kalpatarupower.com વેબસાઈટ : www.kalpatarupower.com સીઆઈએન : L40100GJ1981PLC004281

> નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ, અમદાવાદ બેન્ચમાં CA (CAA) No. 43/NCLT/AHM/2022 કંપની અદિનિયમ, ૨૦૧૩ની કલમો ૨૩૦ થી ૨૩૨ અને અન્ય લાગુ પડતી જોગવાઈઓના મામલામાં

જેએમસી પ્રોજેક્ટસ (ઈન્ડિયા) લિમિટેડના કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ અને તેમના સંબંધિત શેરધારકોનાં એકીકરણની ચોજનાના મામલામાં.

કલ્પતર પાવર ટ્રાન્સમિશન લિમિટેડ, કંપની અધિનિયમ, ૧૯૫૬ હેઠળ) र्धन्डोपोरेट थयेल इंपनी, षेनो डोपोरेट आईडेन्टिटी नंजर:) L40100GJ1981PLC004281 અને તેની નોંધણી થયેલ ઓફિસ પ્લોટ)

..... કંપની / ટ્રાન્સફરી કંપની નં. ૧૦૧, ભાગ-III, જી.આઈ.ડી.સી. એસ્ટેટ, સેક્ટર-૨૮, ગાંધીનગર-) ૩૮૨૦૨૮, ગુજરાત, ભારત ખાતે છે.

કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોને એકત્રિત કરતી મીટિંગ માટેની નોટિસની જાહેરાત

ઝાથી આ નોટિસ આપવામાં આવે છે કે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલની અમદાવાદ બેન્ચ **("ટ્રિબ્યૂનલ"**)ના તારીખ 3જી ઓગસ્ટ, ૨૦૨૨ના હુકમ ("**ટ્રિબ્યૂનલ ઓર્ડર**") દ્વારા કંપની અધિનિયમ, ૨૦૧૩ ("**એક્ટ**")ની ક્લમ ૨૩૦થી ૨૩૨ તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ જેએમસી પ્રોજેક્ટસ (ઈન્ડિયા) લિમિટેડ <mark>("ટ્રાન્સફરર</mark> **કંપની")** ना કत्पतरू पावर ट्रान्सिमशन લિમિટેડ ("**કંપની"** અથવા "**ટ્રાન્સફરી કંપની"**) तथा तेना संબંધિत શેરધારકોના એકીકરણી યોજના ("સ્કીમ")ની પ્રસ્તાવિત યોજનાને ધ્યાનમાં લેવા, અને જો યોગ્ય જણાય તો, સુધારો(૨ા) સાથે મંજૂર કરવા કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોની મીટિંગનું આયોજન કરવા સૂચિત કરવામાં આવેલ છે.

આ ટ્રિબ્યૂનલ ઓર્ડરના અનુસંધાને તથા તેના નિર્દેશ મુજબ, પુન: આ નોટિસ આપવામાં આવે છે કે, નોટિસમાં આપેલ કામકાજ ચલાવવા એક્ટની લાગુ પડતી જોગવાઈઓ સહિત વંચાણે લેતા ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાચર્મેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ની પૂર્તતા કરતા કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોની મંગળવાર, છઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે (ભા.મા.સ.) વિડીયો કોન્ફરન્સિંગ ("**વીસી"**)/ અન્ય દેશ્યશ્રાવ્ય માધ્યમ ("**ઓએવીએમ"**)થી આયોજિત કરવામાં આવશે.

ટ્રિબ્યૂનલ ઓર્ડર અન્વયે તથા તેમાંના નિર્દેશ મુજબ, ઉપરોક્ત મીટિંગની નોટિસ સાથે જરૂરી દસ્તાવેજો જે ઈક્વિટી શેરહોલ્ડરોના ઈ-મેલ આઈડી કંપની રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ ("આરટીએ") જે લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ્સ લિમિટેડ અથવા ડિપોઝિટરીઝ અથવા કંપની પાસે રજિસ્ટર થયેલ છે તેમને ઈલેક્ટ્રોનિક મોડમાં મોક્લી દેવામાં આવેલ છે.

અધિનિયમની કલમ ૨૩૦ થી ૨૩૨ સહિત વંચાણે લેતા કલમ ૧૦૨ અને અન્ય લાગુ પડતી જોગવાઈઓ સહિત વંચાણે લેતા કંપનીઝ (કોમ્પ્રોમાઈઝિસ, અરેન્જમેન્ટ્સ અને અમાલ્ગમેશન્સ) નિયમો, ૨૦૧૬ (**સીએએ રૂલ્સ)** હેઠળ સ્કીમની કોપી, સ્ટેટમેન્ટ તથા સહાયક દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.kalpatarupower.com સેન્ટ્રલ ડિપોઝીટરીઝ સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઈટ જે <u>www.evotingindia.com</u> જે કંપની દ્વારા ઈ-વોટિંગ સુવિધા તથા મીટિંગ બોલાવવાની અન્ય સુવિધાઓ પ્રદાન કરવા નિયુક્ત કરાયેલ છે તથા સ્ટોક એક્સરોન્જ, જે બીએસર્ઇ લિમિટેડ ("**બીએસર્ઇ"**) ની વેબસાઈટ, જે <u>www.bseindia.com</u> અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડિયા લિમિટેડ ("એનએસઈ") ની વેબસાઈટ જે www.nseindia.com છે. તેમની ઉપર જોઈ શકાશે/ડાઉનલોડ કરી શકાશે, જો વ્યક્તિ ચાહે તો આ સ્કીમની ભૌતિક કોપી, સ્ટેટમેન્ટ એક્ટની કલમ ૨૩૦ થી ૨૩૨ સહિત વંચાણે લેતા કલમ ૧૦૨ તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ તથા સીએએ રૂલ્સના નિયમ દ્ વગેરે હેઠળ વિનામૂલ્યે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ પરથી મેળવી શકાશે અથવા આ સંબંધે લેખિત અરજી, કંપનીના કમ્પ્લાયન્સ ઓફિસરને cs@kalpatarupower.com પર મોકલી શકાશે. અથવા એડવોકેટની ઓફિસ જે ઠક્કર એન્ડ પાહવા, એડવોકેટ્સ, ૭૧ ન્યૂચોર્ક ટાવર-એ, મુક્તિધામ દેરાસર સામે, થલતેજ, અમદાવાદ-

આ ટ્રિબ્યૂનલે મે. ઉમેશ વેદ એન્ડ એસોસિએટ્સના શ્રી ઉમેશ વેદ (મેમ્બરશિપ નં. FCS 4411) પ્રેક્ટિસિંગ કંપની સેકેટરીઝને નિયુક્ત કરેલ છે, જે કસૂર કરતા મે. રવિ કપૂર એન્ડ એસોસિએટ્સનાં શ્રી રવિ કપૂર, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝને ઉપરોક્ત મીટિંગ માટે ચેરપર્સન તરીકે નિયુક્ત કરેલ છે.

શ્રી ઉર્મિલ વેદ (મેમ્બરશિપ નં. FCS 8094), પ્રેક્ટિસિંગ કંપની સેકેટરી અને તે કસૂર કરતા શ્રી ઉમેશ પરીખ (મેમ્બરશિપ નં. FCS 4152), મે. પરીખ દવે એન્ડ એસોસિએટ્સના પાર્ટનર, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝ ઉપરોક્ત મીટિંગ માટે સ્કુટિનાઈઝર તરીકે કાર્ય કરશે. જો મીટિંગમાં કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો જો ઉપરોક્ત સ્કીમને મંજૂર કરશે તો, તે અનુગામી ટ્રિબ્યૂનલની મંજૂરી તથા અન્ય આવી મંજૂરીઓ, પરવાનગીઓ તથા નિયમનકારી કે અન્ય સત્તાધિકારીઓની જરૂરી મંજૂરીઓને અધીન રહેશે.

કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરો ઉપરોક્ત મીટિંગમાં હાજરી રહી વોટ કરી શકશે. અને તેઓ નોટિસમાં આપેલ સૂચનાઓનું અનુસરણ કરી મીટિંગની તારીખ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમના વોટ આપી શક્શે અથવ મીટિંગ દરમિયાન વ્યક્તિગતરૂપે ઈ–વોટિંગથી વોટ આપી શકશે. અલબત્ત, આ મીટિંગ વીસી/ઓએવીએમ દ્વારા આયોજિત થનાર હોવાથી ઈક્વિટી શેરહોલ્ડરોની ભૌતિક ઉપસ્થિતિ જતી કરવામાં આવેલ છે. તદનુસાર મીટિંગ માટે ઈક્વિટી શેરહોલ્ડરો દ્વારા પ્રતિનિધિની નિયુક્તીની સુવિધા ઉપલબ્ધ નથી. સભ્ય પોતાના રિમોટ ઈ-વોટિંગ દ્વારા વોટ આપવાના અધિકારનો ઉપયોગ કર્યા પછી પણ મીટિંગમાં ભાગ લઈ શકશે પરંતુ તે મીટિંગ દરમિયાન ફરીથી વોટ આપી શકશે નહીં.

ઉપરોક્ત મીટિંગની ઈ-વોટિંગ માટેની કટ-ઓફ તારીખ અને રિમોટ ઈ-વોટિંગ માટેનો સમયગાળો નીચે મુજળ

રહેશે.	
ઇક્વિટી શેરહોલ્ડર મીટિંગ	
ઈ–વોટિંગ માટે કટ–ઓફ તારીખ	મંગળવાર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૨
રિમોટ ઈ-વોટિંગ પ્રારંભ તારીખ અને સમય	શુક્રવાર, રજી સ્ટેમ્બર, ૨૦૨૨ સવારે ૯.૦૦ કલાકે (ભા.મા.સ.)
રિમોટ ઈ-વોટિંગ બંધ તારીખ અને સમય	સોમવાર, પમી સપ્ટેમ્બર, ૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાકે (ભા.મા.સ.)
ઉપરોક્ત તારીખ અને સમય બાદ રિમોટ-ઇ-	વોટિંગની પરવાનગી રહેશે નહીં અને ઉપરોક્ત સમયગાળો પૂર્ણ થતા

સીડીએસએલ દ્વારા આ રિમોટ ઈ-વોટિંગ મોડ્યૂલ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

ઈક્વિટી શેરહોલ્ડર, જેમના નામ સભ્યોના રજીસ્ટર અથવા ડિપોઝિટરિઝ દ્વારા જળવાતા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં કટ-ઓફ તારીખ જે મંગળવાર ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ નોંધાયેલ હશે તે નોટિસમાં પ્રસ્તાવિત ઠરાવ પર પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કરી શકશે અને મીટિંગમાં હાજર રહી શકશે. ઈક્વિટી શેરહોલ્ડર/બેનિફિશ્ચલ ઓનર (ઈલેક્ટ્રોનિક શેરહોલ્ડિંગના કેસમાં)ના વોટિંગ અધિકાર કટ-ઓફ તારીખે કંપનીના પેઈડ–અપ ઈક્વિટી શેર કેપિટલમાં તેના શેર હોલ્ડિંગનો પ્રમાણમાં રહેશે. જે વ્યક્તિઓએ શેર લીધા હોય અને કંપની દ્વારા આ મિટીંગની નોટિસ મોકલ્યા બાદ ઈક્વિટી શેરહોલ્ડર બન્યા હોય અને જો તેમના નામ કટ-ઓફ તારીખે સભ્યોના રજીસ્ટર અથવા વેબસાઈટ પર અથવા લાભાર્થી ધારકોના રજીસ્ટરમાં દેખાતા હોય તો તેઓ કંપનીની વેબસાઈટ પર મીટિંગની નોટિસ જોઈ શકે છે. આ વ્યક્તિઓ આ મીટિંગની નોટિસમાં આપેલ કાર્યવાહી કરીને લોગ-ઈન આઈડી અને પાસવર્ડ મેળવી શકશે/જનરેટ કરી શકશે.

ભૌતિકરૂપે શેર ધરાવનાર શેરધારકો, જેમણે કંપનીમાં તેમના ઈ-મેલ આઈડી રજીસ્ટર કરાવેલ નથી/અપડેટ કરેલ નથી તેમને કંપનીને તેમના ફોલિયા નંબરની વિગતો તથા સ્વપ્રમાણિત પાનકાર્ડની નકલ સહિત કંપનીના રજીસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટસ, લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને <u>ahmedabad@linkintime.co.in</u> અથવા કંપનીને <u>cs@kalpatarupower.com</u> પર લેખિતમાં અરજી કરવા સૂચિત કરવામાં આવે છે.

ડિમટિરિયલાઈઝ્ડ રૂપે શેર ધરાવતા શેરધારકો, જેમણે તેમનાં ઈ-મેલ આઈડી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(ટો) પાસે રિજસ્ટર કરાવેલ નથી, તેમને તેઓ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(ટો) સાથે ડિમેટ એકાઉન્ટસ ધરાવતા હોય તેમની પાસે ઈમેલ એડ્રેસ રજિસ્ટર કરવા/અપડેટ કરવા સૂચિત કરવામાં આવે છે.

જે ઈક્વિટી શેર હોલ્ડર આ સ્કીમ સંબંધે કોઈ માહિતી મેળવવા માંગતા હોય અથવા ઉપરોક્ત મીટિંગમાં ધ્યાનમાં લેવાની પ્રસ્તાવિત વિષયવસ્તુ વિશે જાણવા માંગતા હોય તેમને કંપનીને શુક્રવાર, રદ્દ મી ઓગસ્ટ, ૨૦૨૨ સુધી અથવા તે પહેલાં <u>cs@kalpatarupower.com</u> પર ઈ–મેલ દ્વારા લેખિતમાં અરજ કરવા જણાવવામાં આવે છે.

ઈ-વોટિંગ સંબંધિત પૂછપરછ માટે, ઈક્વિટી શેર હોલ્ડરોને નીચે આપેલ સંપર્ક વિગતોની નોંધ કરવા સૂચિત કરવામાં આવે છે.

શ્રી રાકેશ દલવી, સિ. મેનેજર સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ મેરેથોન ફ્યુચરેક્સ, એ-વિંગ, ૨૫ મો માળ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-૪૦૦૦૧૩ ઈ–મેલ આઈડી : helpdesk.evoting@cdslindia.com સંપર્ક નં. : ૦૨૨-૨૩૦૫૮૭૩૮ અને ૦૨૨-૨૩૦૫૮૫૪૨-૪૩

ઝન્ય પૂછપરછ માટે, ઈક્વિટી શેર હોલ્ડરોને નીચે આપેલ સંપર્ક વિગતોની નોંધ કરવા સૂચિત કરવામાં આવે છે.

લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ૫૦૬-૫૦૮, અમરનાથ બિઝનેસ સેન્ટર-૧ ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્નર પાસે,

ઓફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-3૮૦૦૦૯, ગુજરાત, ભારત.

ઈ-મેલ : ahmedabad@linkintime.co.in ટેલિ. અને ફેક્સ : ૯૧ ૭૯ ૨૬૪૬૫૧૭૯

તારીખ : ૫મી ઓગસ્ટ, ૨૦૨૨ કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોની મીટિંગ માટે નિયુક્ત ચેરપર્સન

૩૮૦૦૧૫, ગુજરાત, ભારત ખાતે છે.

જેએમસી પ્રોજેક્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડ (કલ્પતરૂ ગ્રૂપ કંપની)

રજી.ઓફિસ: એ-૧૦૪, શપથ ૪, કર્ણાવતી કલબ સામે, એસ. જી. રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ **टेली** : ०७८ इ८१६१५००, ३५स : ०७८ इ८१६१५६०

(3) ઓનલાઈન સબમીશન કરવાની છેલ્લી તારીખ અને સમય!

ઈ-મેલ : cs@jmcprojects.com, વેબસાઈટ : www.jmcprojects.com સીઆઈએન : L45200GJ1986PLC008717

> નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ, અમદાવાદ બેન્ચમાં CA (CAA) No. 43/NCLT/AHM/2022 કંપની અદિનિયમ, ૨૦૧૩ની કલમો ૨૩૦ થી ૨૩૨ અને અન્ય લાગુ પડતી જોગવાઈઓના મામલામાં

જેએમસી પ્રોજેક્ટસ (ઇન્ડिયા) લિમિટેડના કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ અને તેમના સંબંધિત શેરદારકોનાં એકીકરણની ચોજનાના મામલામાં.

જેએમસી પ્રોજેક્ટસ (ઇન્ડિયા) લિમિટેડ, કંપની અધિનિયમ, ૧૯૫૬ હેઠળ) ઇन्डोपोंरेट थयेल इंपनी शेनो डोपोंरेट आઇडेन्टिटी नं.) L45200GJ1986PLC608717 અને તેની નોંધણી થયેલ ઓફિસ એ-) ૧૦૪, શપથ ૪, કર્ણાવતી કલબ સામે, એસ.જી.રોડ, અમદાવાદ-) કંપની / ટ્રાન્સફરર કંપની

કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોને એકત્રિત કરતી મીટિંગ માટેની નોટિસની જાહેરાત

આથી આ નોટિસ આપવામાં આવે છે કે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલની અમદાવાદ બેન્ય ("દ્રિબ્યૂનલ")ન તારીખ 3જી ઓગસ્ટ, ૨૦૨૨ના હુકમ ("ટ્રિ**ડ્યૂનલ ઓર્ડર**") દ્વારા કંપની અધિનિયમ, ૨૦૧૩ ("એક્ટ")ની ક્લમ ૨૩૦થી ૨૩૨ તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ જેએમસી પ્રોજેક્ટસ (ઈન્ડિયા) લિમિટેડ ("કંપની" અથવા "ટાન્સકરર કંપની")ના કત્પતર પાવર ટાન્સમિશન લિમિટેડ ("ટાન્સકરી કંપની") તથા તેના સંબંધિત शेरधारङोना એકीङरणी योपना ("रुडीम")नी प्रस्तावित योपनाने ध्यानमां लेवा, अने प्रो योग्य प्रणाय तो સુધારો(૨ા) સાથે મંજૂર કરવા કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોની મીટિંગનું આયોજન કરવા સૂચિત કરવામાં આવેલ છે.

આ દ્રિબ્યૂનલ ઓર્ડરના અનુસંધાને તથા તેના નિર્દેશ મુજબ, પુનઃ આ નોટિસ આપવામાં આવે છે કે, નોટિસમાં આપેલ કામકાજ ચલાવવા એક્ટની લાગુ પડતી જોગવાઈઓ સહિત વંચાણે લેતા ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાચર્મેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ની પૂર્વતાં કરતા કંપનીના ઈક્વિટી શેરહોલ્ડરોની મંગળવાર, છઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે (ભા.મા.સ.) વિડીયો કોન્ફરન્સિંગ ("**વીસી"**)/ અન્ય દેશ્યશ્રાવ્ય માધ્યમ ("**ઓએવીએમ"**)થી આયોજિત કરવામાં આવશે.

ट्रिज्यूनલ ઓર્ડર અન્વયે તથા તેમાંના નિર્દેશ મુજબ, ઉપરોક્ત મીટિંગની નોટિસ સાથે જરૂરી દસ્તાવેજો જે ઇક્વિટી શેરહોલ્ડરોના ઇ-મેલ આઇડી કંપની રિજસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ ("આરટીએ") જે લિન્ક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ્સ લિમિટેડ અથવા ડિપોઝિટરીઝ અથવા કંપની પાસે રજિસ્ટર થયેલ છે તેમને ઈલેક્ટ્રોનિક મોડમાં મોક્લી દેવામાં આવેલ છે.

અધિનિયમની કલમ ૨૩૦ થી ૨૩૨ સહિત વંચાણે લેતા કલમ ૧૦૨ અને અન્ય લાગુ પડતી જોગવાઈઓ સહિત વંચાણે લેતા કંપનીઝ (કોમ્પ્રોમાઈઝિસ, અરેન્જમેન્ટ્સ અને અમાલ્ગમેશન્સ) નિયમો, ૨૦૧૬ (સીએએ રૂલ્સ) હેઠળ સ્કીમની કોપી, સ્ટેટમેન્ટ તથા સહાયક દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.jmcprojects.com સેન્ટ્રલ ડિપોઝીટરીઝ સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઈટ જે www.evotingindia.com જે કંપની દ્વારા ઈ-વોટિંગ સુવિધા તથા મીટિંગ બોલાવવાની અન્ય સુવિધાઓ પ્રદાન કરવા નિયુક્ત કરાયેલ છે તથા સ્ટોક એક્સચેન્જ, જે બીએસર્ઇ લિમિટેડ ("**બીએસર્ઇ"**) ની વેબસાઈટ, જે <u>www.bseindia.com</u> અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડિયા લિમિટેડ ("એનએસઈ") ની વેબસાઈટ જે www.nseindia.com છે. તેમની ઉપર જોઈ શકાશે/ડાઉનલોડ કરી શકાશે, જો વ્યક્તિ ચાહે તો આ સ્કીમની ભૌતિક કોપી, સ્ટેટમેન્ટ એક્ટની કલમ ૨૩૦ થી ૨૩૨ સહિત વંચાણે લેતા કલમ ૧૦૨ તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ તથા સીએએ રૂલ્સના નિયમ દૃ વગેરે હેઠળ વિનામૂત્યે કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ પરથી મેળવી શકાશે અથવા આ સંબંધે લેખિત અરજી કંપનીના કંપની સેકેટરીને cs@jmcprojects.com અથવા એડવોકેટની ઓફિસ જે ઠક્કર એન્ડ પાહવા, એડવોકેટ્સ, ૭૧ ન્યૂચોર્ક ટાવર-એ, મુક્તિધામ દેરાસર સામે, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪ પાસેથી મેળવી શકાશે.

આ ટ્રિબ્યુનલે મે. ઉમેશ વેદ એન્ડ એસોસિએટ્સના શ્રી ઉમેશ વેદ (મેમ્બરશિપ નં. FCS 4411) પ્રેક્ટિસિંગ કંપની સેકેટરીઝને નિયુક્ત કરેલ છે, જે કસૂર કરતા મે. રવિ કપૂર એન્ડ એસોસિએટ્સનાં શ્રી રવિ કપૂર, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝને ઉપરોક્ત મીટિંગ માટે ચેરપર્સન તરીકે નિયુક્ત કરેલ છે.

श्री ઉર્મિલ વેદ (મેમ્બરશિપ નં. FCS 8094), પ્રેક્ટિસિંગ કંપની સેકેટરી અને તે કસ્**ર કરતા શ્રી ઉમેશ પ**રીખ (મેમ્બરશિપ નં. FCS 4152), મે. પરીખ દવે એન્ડ એસોસિએટ્સના પાર્ટનર, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝ ઉપરોક્ત મીટિંગ માટે સ્કુટિનાઇઝર તરીકે કાર્ચ કરશે. જો મીટિંગમાં કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો જો ઉપરોક્ત સ્કીમને મંજૂર કરશે તો, તે અનુગામી ટ્રિબ્યુનલની મંજૂરી તથા અન્ય આવી મંજૂરીઓ, પરવાનગીઓ તથા નિયમનકારી કે અન્ય સત્તાધિકારીઓની જરૂરી મંજૂરીઓને અધીન રહેશે.

કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરો ઉપરોક્ત મીટિંગમાં હાજરી રહી વોટ કરી શકશે. અને તેઓ નોટિસમાં આપેલ સૂચનાઓનું અનુસરણ કરી મીટિંગની તારીખ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમના વોટ આપી શકશે અથવા મીટિંગ દરમિયાન વ્યક્તિગતરૂપે ઈ–વોટિંગથી વોટ આપી શકશે. અલબત્ત, આ મીટિંગ વીસી/ઓએવીએમ દ્વાર આચોજિત થનાર હોવાથી ઇક્વિટી શેરહોલ્ડરોની ભૌતિક ઉપસ્થિતિ જતી કરવામાં આવેલ છે. તદનુસાર મીટિંગ માટે ઈક્વિટી શેરહોલ્ડરો દ્વારા પ્રતિનિધિની નિયુક્તીની સુવિધા ઉપલબ્ધ નથી. સભ્ય પોતાના રિમોટ ઈ-વોટિંગ દ્વારા વોટ આપવાના અધિકારનો ઉપયોગ કર્યા પછી પણ મીટિંગમાં ભાગ લઈ શકશે પરંતુ તે મીટિંગ દરમિયાન ફરીથી વોટ આપી શકશે નહીં.

ઉપરોક્ત મીટિંગની ઈ-વોટિંગ માટેની કટ-ઓફ તારીખ અને રિમોટ ઈ-વોટિંગ માટેનો સમયગાળો નીચે મુજબ

ઈક્વિટી શેરહોલ્ડર મીટિંગ	
ઈ–વોટિંગ માટે કટ–ઓફ તારીખ	મંગળવાર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૨
રિમોટ ઈ-વોટિંગ પ્રારંભ તારીખ અને સમય	શુક્રવાર, રજી સ્ટેમ્બર, ૨૦૨૨ સવારે ૯.૦૦ કલાકે (ભા.મા.સ.)
રિમોટ ઈ-વોટિંગ બંધ તારીખ અને સમય	સોમવાર, પમી સપ્ટેમ્બર, ૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાકે (ભા.મા.સ.)
	વોટિંગની પરવાનગી રહેશે નહીં અને ઉપરોક્ત સમયગાળો પર્ણ થ

સીડીએસએલ દ્વારા આ રિમોટ ઈ-વોટિંગ મોડ્યૂલ નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

ઈક્વિટી શેરહોલ્ડર, જેમના નામ સભ્યોના રજ઼સ્ટર અથવા ડિપોઝિટરિઝ દ્વારા જળવાતા લાભાર્થી માલિકોના રિજસ્ટરમાં કટ-ઓફ તારીખ જે મંગળવાર ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ નોંધાયેલ હશે તે નોટિસમાં પ્રસ્તાવિત ઠરાવ પર પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કરી શકશે અને વીસી/ઓએસીએમ દ્વારા મીટિંગમાં હાજર રહી શકશે. ઈક્વિટી શેરહોલ્ડર/બેનિફિશ્ચલ ઓનર (ઈલેક્ટ્રોનિક શેરહોલ્ડિંગના કેસમાં)ના વોટિંગ અધિકાર કટ-ઓફ તારીખે કંપનીના પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલમાં તેના શેર હોલ્ડિંગનો પ્રમાણમાં રહેશે. જે વ્યક્તિઓએ શેર લીધા હોય અને કંપની દ્વારા આ મિટીંગની નોટિસ મોકલ્યા બાદ ઈક્વિટી શેરહોલ્ડર બન્યા હોય અને જો તેમના નામ કટ-ઓક તારીખે સભ્યોના રજસ્ટર અથવા વેબસાઈટ પર અથવા લાભાર્થી ધારકોના રજસ્ટરમાં દેખાતા હોય તો તેઓ કંપનીની વેબસાઈટ પર મીટિંગની નોટિસ જોઈ શકે છે. આ વ્યક્તિઓ આ મીટિંગની નોટિસમાં આપેલ કાર્ચવાહી કરીને લોગ-ઈન આઈડી અને પાસવર્ડ મેળવી શકશે/જનરેટ કરી શકશે.

ભૌતિકરૂપે શેર ધરાવનાર શેરધારકો, જેમણે કંપનીમાં તેમના ઈ-મેલ આઈડી રજીસ્ટર કરાવેલ નથી/અપડેટ કરેલ નથી તેમને કંપનીને તેમના ફોલિયા નંબરની વિગતો તથા સ્વપ્રમાણિત પાનકાર્ડની નકલ સહિત કંપનીના રજસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટસ, લિન્ક ઇનટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ahmedabad@linkintime.co.ir અથવા કંપનીને cs@jmcprojects.com પર લેખિતમાં અરજી કરવા સૂચિત કરવામાં આવે છે.

ડિમટિરિયલાઈઝ્ડ રૂપે શેર ધરાવતા શેરધારકો, જેમણે તેમનાં ઈ-મેલ આઈડી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(ટો) પાસે રિજસ્ટર કરાવેલ નથી, તેમને તેઓ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ(ટો) સાથે ડિમેટ એકાઉન્ટસ ધરાવતા હોય તેમની પાસે ઈમેલ એડ્રેસ રજિસ્ટર કરવા/અપડેટ કરવા સૂચિત કરવામાં આવે છે.

જે ઈક્વિટી શેર હોલ્ડર આ સ્કીમ સંબંધે કોઈ માહિતી મેળવવા માંગતા હોય અથવા ઉપરોક્ત મીટિંગમાં ધ્યાનમાં લેવાની પ્રસ્તાવિત વિષયવસ્તુ વિશે જાણવા માંગતા હોય તેમને કંપનીને શુક્રવાર, રદ્દમી ઓગસ્ટ, ૨૦૨૨ સુધી અથવા તે પહેલાં <u>cs@jmcprojects.com</u> પર ઈ-મેલ દ્વારા લેખિતમાં અરજ કરવા જણાવવામાં આવે છે.

ઈ-વોટિંગ સંબંધિત પૂછપરછ માટે, ઈક્વિટી શેર હોલ્ડરોને નીચે આપેલ સંપર્ક વિગતોની નોંધ કરવા સૂચિત કરવામાં આવે છે.

શ્રી રાકેશ દલવી, સિ. મેનેજર સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ મેરેથોન ફ્યુચરેક્સ, એ-વિંગ, ૨૫ મો માળ,

એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-૪૦૦૦૧૩

ઈ–મેલ આઈડી : helpdesk.evoting@cdslindia.com

સંપર્ક નં. : ૦૨૨-૨૩૦૫૮૭૩૮ અને ૦૨૨-૨૩૦૫૮૫૪૨-૪૩

અન્ય પૂછપરછ માટે, ઇક્વિટી શેર હોલ્ડરોને નીચે આપેલ સંપર્ક વિગતોની નોંધ કરવા સૂચિત કરવામાં આવે છે.

લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ૫૦૬-૫૦૮, અમરનાથ બિઝનેસ સેન્ટર-૧ ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્નર પાસે, ઓફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-3૮૦૦૦૯, ગુજરાત, ભારત.

ઇ-મેલ : ahmedabad@linkintime.co.in ટેલિ. અને ફેક્સ : ૯૧ ૭૯ ૨૬૪૬૫૧૭૯

તારીખ: પમી ઓગસ્ટ, ૨૦૨૨

સહી/-

સહી/-શ્રી ઉમેશ વેદ કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરોની મીટિંગ માટે નિયુક્ત ચેરપર્સન





